

---

# Shri Narasimha Mantrarajapada Stotram with Meanings

---

श्रीनरसिंहमन्त्रराजपदस्तोत्रम् सार्थम्

---

## Document Information

---



---

Text title : Shri Narasimha Mantrarajapada Stotram with English meanings

File name : narasiMhamantrarAjastotram.itx

Category : vishhnu, dashAvatAra, mantra, vishnu\_misc, vishnu

Location : doc\_vishhnu

Transliterated by : Vijayaraghavan Bashyam

Proofread by : Vijayaraghavan Bashyam, PSA Easwaran

Translated by : (Copyright) Usha Rani Sanka usharani.sanka at gmail.com

Acknowledge-Permission: <http://kshetrayaatra.blogspot.com>

Latest update : January 23, 2023

Send corrections to : [sanskrit@cheerful.com](mailto:sanskrit@cheerful.com)

---

This text is prepared by volunteers and is to be used for personal study and research. The file is not to be copied or reposted without permission, for promotion of any website or individuals or for commercial purpose.

**Please help to maintain respect for volunteer spirit.**

---

Please note that proofreading is done using Devanagari version and other language/scripts are generated using **sanscript**.

---

January 28, 2023

*sanskritdocuments.org*

---



श्रीनरसिंहमन्त्रराजपदस्तोत्रम् सार्थम्



पाञ्चरात्र आगमीय अडिर्बुध्य संछितात्  
अथ श्रीमन्त्रराजपदस्तोत्रम् ।  
श्री ईश्वर उवाच -  
पृत्तोत्सुल्लविशालाक्षं विपक्षक्षयदीक्षितम् ।  
निनादत्रस्तविश्वाण्डं विष्णुमुग्रं नमाम्यहम् ॥ १ ॥  
सर्वैरवध्यतां प्राप्तं सङ्कलौघं दितेः सुतम् ।  
नभात्रैः शकलीयङ्के यस्तं वीरं नमाम्यहम् ॥ २ ॥  
पादावष्टब्धपातालं मूर्धाऽऽविष्टत्रिविष्टपम् ।  
भुजप्रविष्टाष्टदंशं मडाविष्णुं नमाम्यहम् ॥ ३ ॥  
ज्योतीर्ष्यर्कन्दुनक्षत्रज्वलनादीन्यनुकृमात् ।  
ज्वलन्ति तेजसा यस्य तं ज्वलन्तं नमाम्यहम् ॥ ४ ॥  
सर्वेन्द्रियैरपि विना सर्वं सर्वत्र सर्वदा ।  
जानाति यो नमाम्याद्यं तमहं सर्वतोभुजम् ॥ ५ ॥  
नरवत्सिंहवज्रैव रूपं यस्य मडात्मनः ।  
मडासटं मडादष्टं तं नृसिंहं नमाम्यहम् ॥ ६ ॥  
यन्नामस्मरणाद्भीताः भूतवेतालराक्षसाः ।  
रोगाद्याश्च प्राणशयन्ति भीषणं तं नमाम्यहम् ॥ ७ ॥  
सर्वोऽपि यं समाश्रित्य सकलं भद्रमश्नुते ।  
श्रिया यं भद्रया जुष्टो यस्तं भद्रं नमाम्यहम् ॥ ८ ॥  
साक्षात्स्वकाले सम्प्राप्तं मृत्युं शत्रुगणानपि ।  
भक्तानां नाशयेद्यस्तु मृत्युमृत्युं नमाम्यहम् ॥ ९ ॥  
नमस्कारात्मकं यस्मै विधायात्मनिवेदनम् ।

त्यक्तदुःखोऽभिलान् कामानश्रुते तं नमाम्यहम् ॥ १० ॥

दासभूताः स्वतः सर्वे ह्यात्मानः परमात्मनः ।

अतोऽहमपि ते दास इति मत्वा नमाम्यहम् ॥ ११ ॥

इलश्रुतिः ।

शङ्करेणैवाहारात्प्रोक्तं पदानां तत्त्वमुत्तमम् ।

त्रिसन्ध्यं यः पठेत्तस्य श्रीविद्याऽऽयुश्च वर्धते ॥ १२ ॥

इति श्रीनरसिंहमन्त्रराजपद्यस्तोत्रं सम्पूर्णम् ।

---

# Shri Narasimha Mantrarajapada Stotram with Meanings

---

## श्रीनरसिंहमन्त्रराजपदस्तोत्रम् सार्थम्

---

### Translation of shrInarasiMhamantrarAjapadastotram

---



वृत्तोत्तुल्लविशालाक्षं विपक्षक्षयदीक्षितम् ।

निनादत्रस्तविश्वाएडं विष्णुमुग्रं नमाम्यडम् ॥ १ ॥

I do namaskara (नमाम्यडम्) to the Vishnu, the ferocious one (उग्रं), with round (वृत्त) dilated (उत्तुल्ल) broad big eyes (विशालाक्षं), who vows for (दीक्षितम्) the eradication of (क्षय) the enemies (विपक्ष), who terrifies (त्रस्त) the whole universe (विश्वाएडं) by his shout-sound (निनाद).

1

सर्वैरवध्यतां प्राप्सं सङ्कलौघं दितेः सुतम् ।

नभाग्रैः शकलीयङ्के यस्तं वीरं नमाम्यडम् ॥ २ ॥

I do namaskara (नमाम्यडम्) to the courageous one (वीरं), who made into pieces (शकलीयङ्के) with his nail-ends (नभाग्रैः), the son of Diti (दितेः सुतम्), who had attained (प्राप्सं) the unkillability boon (अवध्यति) from everyone (सर्वैः), and was successful in everything (सङ्कलौघं). 2

पादावष्टब्धपातालं मूर्धाऽऽविष्टत्रिविष्टपम् ।

भुजप्रविष्टाष्टदिशं मडाविष्णुं नमाम्यडम् ॥ ३ ॥

I do namaskara (नमाम्यडम्) to the Great Vishnu (मडाविष्णुं), who seized (अष्टब्ध) the netherworld (पातालं) by his feet (पाद), who occupied (आविष्ट) the heaven (त्रिविष्टपम्) by his head (मूर्धा), who made the eight (अष्ट) directions (दिशं) enter (प्रविष्ट) his shoulders (भुज) covered them all through his shoulders. 3

ज्योतीर्ष्यर्केन्दुनक्षत्रज्वलनादीन्यनुकमात् ।

ज्वलन्ति तेजसा यस्य तं ज्वलन्तं नमाम्यडम् ॥ ४ ॥

I do namaskara to the blazing one (ज्वलन्तं), by whose (यस्य) lustre (तेजसा), the luminary planets (ज्योतीर्षि), the Sun (अर्क), the Moon (एन्दु), the stars (नक्षत्र) and other heavenly bodies (ज्वलनादीनि) one by one (अनुकमात्) shine (ज्वलन्ति). 4

सर्वेन्द्रियैरपि विना सर्वं सर्वत्र सर्वदा ।

जानाति यो नमाम्याद्यं तमहं सर्वतोभुजम् ॥ ५ ॥

I do namaskara (नमामि) to the one who is “faced-all-sides” (सर्वतोभुजम्), who is the prime-most (आद्यं), and who knows (जानाति) everything (सर्वं), everywhere (सर्वत्र), always (सर्वदा), even without (विना) having any (अल्प) sense organs (सर्वेन्द्रियैरपि). 5

नरवत्सिंहवच्चैव रूपं यस्य महात्मनः ।

महासटं महादंष्ट्रं तं नृसिंहं नमाम्यहम् ॥ ६ ॥

I do namaskara (नमाम्यहम्) to that man-lion (नृसिंहं), the great soul (महात्मनः) whose form (रूपं) is like a man (नरवत्) and also a lion (सिंहवच्चैव), who has large matted hair (महासटं) and very big teeth (महादंष्ट्रं). 6

यत्रामस्मरणाद्भीताः भूतवेतालराक्षसाः ।

रोगाद्याश्च प्रणश्यन्ति भीषणं तं नमाम्यहम् ॥ ७ ॥

I do namaskara (नमाम्यहम्) to the fiersome one (भीषणं), by remembering whose name (यन्-नाम-स्मरणाद्) the surviving undead souls (भूत), evil spirits (वेताल) and demons (राक्षसाः) are afraid (भीताः), and the diseases etc. (रोगाद्याश्च) get destroyed (प्रणश्यन्ति). 7

सर्वोऽपि यं समाश्रित्य सकलं भद्रमश्नुते ।

श्रिया य भद्रया जुष्टो यस्तं भद्रं नमाम्यहम् ॥ ८ ॥

I do namaskara (नमाम्यहम्) to the protectful one (भद्रं), by seeking refuge of whom (यं समाश्रित्य) everyone (सर्वोऽपि) attains (अश्नुते) all kinds of (सकलं) the auspicious (भद्रम्), who is served (जुष्टो) by the goddess of wealth (श्रिया य - Lakshmi) and goddess of protection (भद्रया). 8

साक्षात्स्वकाले सम्प्राप्तं मृत्युं शत्रुगणानपि ।

भक्तानां नाशयेद्भक्तु मृत्युमृत्युं नमाम्यहम् ॥ ९ ॥

I do namaskara (नमाम्यहम्) to the death of the death (मृत्युमृत्युं), one who (यस्तु) destroys (नाशयेद्) the death (मृत्युं) that is approaching (सम्प्राप्तं) directly (साक्षात्) at his own apt time (स्वकाले) and the teams of enemies (शत्रुगणानपि) of the devotees (भक्तानां). 9

नमस्कारात्मकं यस्मै विधायान्निवेदनम् ।

त्यक्तदुःखोऽभिलान् कामानश्नुते तं नमाम्यहम् ॥ १० ॥

I do namaskara (नमाम्यहम्) to the one, to whom (यस्मै) by completely submitting self (विधाय आत्मनिवेदनम्) through the form of doing the namaskara (नमस्कारात्मकं), (अने) becomes free-of-misery (त्यक्तदुःखो) and attains (अश्नुते) all (अभिलान्) desires (कामान्). 10

दासभूताः स्वतः सर्वे ज्यात्मानः परमात्मनः ।

अतोऽहमपि ते दास इति मत्वा नमाम्यहम् ॥ ११ ॥

All the souls (people, सर्वे ज्यात्मानः) are like servants (दासभूताः) of the Supreme soul (परमात्मनः). Hence I am also (अतोऽहमपि) your servant (ते दास ( thinking so (इति मत्वा) I do namaskara (नमाम्यहम्). 11

शङ्करेणादशप्रोक्तं पदानां तत्त्वमुत्तमम् ।


त्रिसन्ध्यं यः पठेत्तस्य श्रीविद्याऽऽयुश्च वर्धते ॥ १२ ॥

The supreme (उत्तमम्) essence (तत्त्वम्) of the words (पदानां) (इन् थे मन्त्र श्लोक) is told (प्रोक्तं) by Shiva (शङ्करेन) with honour (आदशत्). One who reads (यः पठेत्) it all three sandhya times, (त्रिसन्ध्यं) his (तस्य) wealth (श्रीः), knowledge (विद्या) and life span (आयुश्च) get increased (वर्धते). 12


Proofread by PSA Easwaran

(Copyright) Translation by Usha Rani Sanka usharani.sanka at gmail.com

---

——  
*Shri Narasimha Mantrarajapada Stotram with Meanings*

pdf was typeset on January 28, 2023

——  
Please send corrections to [sanskrit@cheerful.com](mailto:sanskrit@cheerful.com)

